

Seat No. : \_\_\_\_\_

# AP-116

April-2022

B.Com., Sem.-IV

## 210 : Fundamental Statistics

Time : 2 Hours]

[Max. Marks : 50]

- સૂચનાઓ : (1) વિભાગ-Iમાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબ લખો.  
(2) વિભાગ-IIમાં પ્રશ્ન 5 ફરજિયાત છે.  
(3) સાદા ગણન્યંત્રનો ઉપયોગ કરી શકાશે.  
(4) જરૂરી કોષ્ટક કિંમતો પ્રશ્નપત્રના અંતે આપેલ છે.

### વિભાગ - I

1. (A) વિકલનની વ્યાખ્યા આપો અને તેનો ઉપયોગ કરીને  $f(x) = (4x^2 + 8)$  નું વિકલન ફળ મેળવો. 20  
(B) નીચેના પરથી  $\frac{dy}{dx}$  મેળવો : (કોઈપણ બે)  
(i)  $(3x - 5)(y + 7) = 8$   
(ii)  $y = \log(x^7 \cdot 7^x \cdot e^{7x})$   
(iii)  $y = \frac{5^x - 3}{x^2 + 5}$
2. (A) માંગની મૂલ્ય સાપેક્ષતા સમજાવો. વિધેય  $f(x) = 4x^3 + 3x^2 + 12$  ની મહત્તમ અને લઘુત્તમ કિંમત મેળવો. 20  
(B) કોઈ એક વસ્તુનું માંગનું વિધેય  $x = 40 - p$  છે અને ખર્ચનું વિધેય  $C(x) = 6x^2 + 5x + 10$  હોય તો,  
(i) મહત્તમ નક્ષે અને  
(ii) મહત્તમ નક્ષે માટેની કિંમત મેળવો.
3. (A) જથ્થા બંધ ભાવનો સૂચક આંક એટલે શું ? તેની રચનાના મુખ્ય મુદ્દાઓ સમજાવો. 20

(B) નીચેની માહિતી પરથી ક્રિશર, ડોર્ભિશ-બાઉલી અને માર્શિલ-એજવર્થનો સૂચકાંક શોધો :

વસ્તુઓ	2020		2022	
	ખર્ચ	જથ્થો	ખર્ચ	જથ્થો
P	78	26	120	30
Q	120	15	200	20
R	72	12	135	15
S	50	5	120	10
T	28	7	45	9

4. (A) સામયિક શ્રેણીનું પૃથક્કરણ સમજાવો. સામયિક શ્રેણીના જુદા-જુદા ઘટકોની ચર્ચા કરો.  
(B) નીચેની સામયિક શ્રેણી માટે ચલિત સરેરાશની રીતથી મોસમી વધઘટો શોધો :

વર્ષ	મોસમ		
	શિયાળો	ઉનાળો	ચોમાસું
2018	36	45	30
2019	30	42	24
2020	42	48	33
2021	39	52	27

### વિભાગ - II

5. નીચેના પ્રશ્નોના જવાબ આપો : (કોઈપણ પાંચ)

20

- (1) જો  $y = \log x$ , હોય તો  $\frac{d^2y}{dx^2}$  શોધો.
- (2) જો  $y = x^3 - 3x^2 - 3x + 8$  હોય અને  $\frac{dy}{dx} = -6$  હોય તો  $x$  ની કિંમત શોધો.
- (3) જો  $AR = 14$  અને  $MR = 7$  હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો.
- (4) જો  $f(x) = x^3 + x^2 + x + 5$  હોય તો  $f''(-\frac{1}{2})$  મેળવો.
- (5) વિકલનનો સંકળનો નિયમ અને ગુણાકારનો નિયમ જણાવો.
- (6) જો ડોર્ભિશ-બાઉલી અને લાસ્પેયરનો સૂચકાંક અનુક્રમે 145 અને 157.5 હોય તો ક્રિશરનો સૂચકાંક શોધો.
- (7) કયા સૂચકાંક સમય વિપર્યાસ પરીક્ષણને સંતોષે છે ?
- (8) સામયિક શ્રેણી એટલે શું ?
- (9) સામયિક શ્રેણીમાં અનિયમિત વધઘટ શોધવા માટેનું સૂત્ર આપો.
- (10) સામયિક શ્રેણીમાં મોસમી વધઘટ શોધવા માટેનું સૂત્ર આપો.

Seat No. : \_\_\_\_\_

# AP-116

April-2022

B.Com., Sem.-IV

## 210 : Fundamental Statistics

Time : 2 Hours]

[Max. Marks : 50]

- Instructions :**
- (1) Attempt any two questions in Section – I.
  - (2) Question-5 in Section – II is compulsory.
  - (3) Use of simple calculator is allowed.
  - (4) Necessary tabulated values are given at the end of question paper.

### SECTION – I

1. (A) Give definition of differentiation and use it to obtain derivative of

$$f(x) = (4x^2 + 8).$$

20

- (B) Obtain  $\frac{dy}{dx}$  of the following : (Any two)

(i)  $(3x - 5)(y + 7) = 8$

(ii)  $y = \log(x^7 \cdot 7^x \cdot e^{7x})$

(iii)  $y = \frac{5^x - 3}{x^2 + 5}$

2. (A) Explain demand elasticity. Obtain maximum and minimum value of function  $f(x) = 4x^3 + 3x^2 + 12.$

20

- (B) Demand function of a commodity is  $x = 40 - p$  and its cost function is  $C(x) = 6x^2 + 5x + 10$ . Then find,

(i) Maximum profit and

(ii) Price for maximum profit.

3. (A) What is meant by wholesale price index number ? Explain main steps for the construction of wholesale price index number.

20

- (B) From the following data, find Fisher's, Dorbish-Bowely's and Marshall-Edgeworth's index numbers.

Items	2020		2022	
	Expense	Quantity	Expense	Quantity
P	78	26	120	30
Q	120	15	200	20
R	72	12	135	15
S	50	5	120	10
T	28	7	45	9

4. (A) Explain analysis of time series. Discuss the various components of time series. 20  
(B) Find seasonal variations by moving average method for following time series data :

Year	Season		
	Winter	Summer	Monsoon
2018	36	45	30
2019	30	42	24
2020	42	48	33
2021	39	52	27

## SECTION – II

5. Answer the following : (Any five) 10
- (1) If  $y = \log x$ , find  $\frac{d^2y}{dx^2}$ .
  - (2) If  $y = x^3 - 3x^2 - 3x + 8$  and  $\frac{dy}{dx} = -6$ , find the value of  $x$ .
  - (3) If  $AR = 14$  and  $MR = 7$ , find elasticity of demand.
  - (4) If  $f(x) = x^3 + x^2 + x + 5$ , obtain  $f''(-\frac{1}{2})$ .
  - (5) State the chain rule and multiplication rule of differentiation.
  - (6) If Dorbish-Bowely's and Laspeyre's index numbers is 145 and 157.5, find Fisher's index number.
  - (7) Which index number will satisfy the time reversal test ?
  - (8) What is time series ?
  - (9) Give the formula to calculate irregular variation in time series data.
  - (10) Give the formula to calculate seasonal variation in time series data.